

B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination**Feb/Mar. -2021 (NEW COURSE)****Indirect Tax Law - 1(Dse-3)****Time: 1:30 Hours****Marks: 42****Instructions:**

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ પરોક્ષ કર એટલે શું? તેની લાક્ષણિકતાઓ વર્ણવો. (૧૪)
- પ્રશ્ન.૨ જીએસટી કંપોઝીસન સ્કીમના ફાયદા અને મર્યાદાઓ જણાવો. (૧૪)
- પ્રશ્ન.૩ સમયમાલ પુરવઠાની સમજૂતી આપો. (૧૪)
- પ્રશ્ન.૪ જીએસટી પુરવઠા મુલ્યનાં સંદર્ભમાં નીચેના પદો સમજાવો. (૧૪)
1. એજન્ટ
 2. અવેજ
- પ્રશ્ન.૫ ટ્રેકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
1. CGST અને SGST
 2. પુરવઠામાં સમાવિષ્ટ બાબતો
 3. સેવા પુરવઠાનો સમય
 4. વ્યવહાર મુલ્ય

ENGLISH VERSION

- Q.1 What is Indirect tax? Describe its features. (14)
- Q.2 State merits and demerits of composition scheme under GST. (14)
- Q.3 Explain time supply of Goods. (14)
- Q.4 Explain the following term under value of supply GST? (14)
1. Agent
 2. Considerations
- Q.5 Write a short note. (any two) (14)
1. CGST and SGST
 2. Scope of supply
 3. Time of supply of service
 4. Transaction value
